

35/83

श्री शुद्धोपायश्व  
गुरु गंगामाला।

805

२२३०४६५-७०६०० : अनुकूल  
संस्कृत एवं वेदान्त  
संस्कृत एवं वेदान्त  
संस्कृत एवं वेदान्त

पुस्तकालय  
प्रिति सूमुच्चय



नहि ज्ञानेन सद्वर्णं पवित्रमिह विद्यते ।

—श्रीमहाभगवद्गीता ४-३८.

संग्राहक :

वडोदरा राज्य पुस्तकालय  
परिषद् भंडण-वडोदरा।

[ मार्च, १९३४ ]

भूल्य ३० ०-२-०

प्रकाशक :

पुस्तकालय संस्कृत  
संस्कृत एवं वेदान्त  
वडोदरा भंडण लि।

---

## પ્રા ચ્ય જ નો નાં

---

૧

૧ લોકોએ સંનેંગો ઉપર વિજય મેળવવો જોઈએ અને સમજવું જોઈએ કે વધારે ને વધારે જ્ઞાનપ્રાપ્તિ એ એમની મોટામાં મોટી જરૂરયાત છે. લોકોને પુસ્તકો ચહુંતાં ખનાવવા જોઈએ. આકર્ષક મહાકથો કે સુંદર ચિત્રોને નહિ, પરન્તુ થંથમાંની વસ્તુને લોકો પોતાના જીવનનું એક અવિલાન્ય અંગ ગણુતા થાય એમ કરવું જોઈએ. એમ થાય તો જ પુસ્તકાલય એ જીવનના શોખની વસ્તુ નહિ રહેતાં તેના અસ્તિત્વ માટેની એક આવર્યક ચીજ ખની રહેશે.

૨

૨ જેવી રીતે ઇણ એ આડનું અંતિમ પરિણુંબ છે, તેવી જ રીતે જનસમાજની જ્ઞાન મેળવવાની ધ્યાન તથા સરકાર જે મદ્દ તરીકે કાર્યો કરે છે તેનો, તથા આવી પુસ્તકાલય જેવી સંસ્થાઓનો આખરનો ઉદ્દેશ તથા છેવટનું ઇણ તે સકળ જનસમૂહનું સુખ પ્રાપ્ત કરવું તે છે. એટલે જેવી રીતે આડનું સાક્ષ્ય ઇણમાં છે, તેવી જ રીતે સરકારની તથા લોકોનો તમામ પ્રવૃત્તિઓનું સાક્ષ્ય અભિલ સમૂદ્ધાન ॥ સુખમાં સમાયછું છે.

૩

૩ . નાચક ગમે તે સ્થિતિનો કાં ન હોય પણ થંથપાલ માત્રે |  
એકે .. નાચક પ્રત્યે માયાળું અને વિનયશીલ વર્તેન રાખવાની |  
જરૂર છે.'

પુસ્તકાલયનું કામ કરનારના દીકમાં આ સૂત્ર બરાખર કેતારાઈ  
રહેવું જોઈએ. પુસ્તકાલયની ઝોંગનો આધાર તેના ઉપર જ છે. |

—શ્રીમંત મહુરાજ સર સયાળરાવ ગાયકવાડો

૪ પુસ્તકોમાં હું શુંથાયદો રહી શકતો તેથી મને એ માસ વધારે જેલ મળત, તો પણ હું કાયર થાત નહિ; એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયોગી વધારે કરી શકવાથી હું ઉલટો વધારે સુખચેનમાં રહેત. હું માતું છું કે જેને સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે, તે ગમે તે જગાએ એકાંતવાસ અહેલાઈથી વેઠી શકે છે. એક પછી બીજું, એમ સારાં પુસ્તકો વાંચતાં વાંચતાં છેવટે આંતરવિચાર પણ કરી શકશે.

—મહાત્મા ગાંધીજી.

૫ હૃતાશ થતા દેશભક્તના દિવમાં ઘડીલર આશા ઉત્પન્ન કરે એવી ડિંદની તાકાત અને પ્રગતિ દ્વારી થોડી પ્રવૃત્તિઓમાં પુસ્તકાલયપ્રવૃત્તિ ગણી શકાય. જનસમાજના મનમાં તેણે પોતાના નામમાં રહેલા અર્થ કરતાં વધારે અસર કરી. છે અને દેશની શિક્ષણું પદ્ધતિમાં તે અગત્યના પૂરક તત્ત્વ તરીકે વિસ્તરી છે. ખરું કહું તો પુસ્તકાલય પ્રવૃત્તિની આ વિશાળ બાળુએ એટલી મોટી પ્રતીતિ આપી છે કે રાષ્ટ્રીય સાધનોમાં તેના મહાન ઝાળાની ચારે તરફથી વક્તિલાત થાય છે; અને રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ તેને પોષવાનું દબાણું થઇ રહ્યું છે. સુધરેલા દેશોનાં દષ્ટાન્તો આ વાતની તરફેણુંમાં છે.

—રાઈટ એન. શ્રી નિવાસ શાસ્કી.

૬ એડુક્શન જેમ આપું એતર એડે છે પણ તે સાથે એક જગાએ ઊંડા કૂવો કરે છે, તેજ પ્રમાણે માણુસે જ્ઞાનના બધા વિષયોનો સ્પર્શ કરવો જોઈએ અને તે સાથે એક વિષયમાં ઊંડા ઉત્તરવું જોઈએ.

—ખાણું ક્ષિતિ મોહન સેન.

૭ ઉત્તમ સાહિત્ય દ્વારા આપણે દેશ અને કાળની ભર્યાદી તોડીને અનેક લોકો સાથે બુદ્ધિનો, અને હૃદયનો, વિચારનો અને પ્રેરણનો સંબંધ બાંધી શકીએ છીએ.

૮ પુસ્તકો દ્વારા પ્રત્યક્ષ વ્યક્તિની દરમ્યાનગીરી વગર આપણે જાન, સંસ્કારિતા, આત્માં દ અને પ્રેરણા મેળવીએ છીએ; છતાં અંથપાલ વગરનું પુસ્તકાલય એ મડદા જેવું છે. અંથપાલ અસંખ્ય અંથકારો વચ્ચે અને પ્રજા વચ્ચે આધ્યાત્મિક સંબંધ બાંધી આપનાર ગોર છે. ગોરનો ભૂળ અર્થ જે ગુરુ હોય તો એ ગુરુ છે. પણ ગુરુ કરતાં વધારે એ હિતરસી મિત્ર છે, સ્નેહી છે, સુહૃદ છે. શું ચાહવું ને શું પસંદ કરવું એ શીખવનારને જે આપણે કલાધર કહેતા હોઈએ, તો અંથપાલ એ કલાધર પણ છે. એનો નિર્હુતુક પ્રેમ આખી પ્રજાને જ્ઞાનસમૃદ્ધ, સંસ્કારી અને હીનસેવક બનાવવાને હિનરાત મથે છે.

૯ ઉત્તમ અંથસંઅહ અને ઉત્તમ અંથપાલની યોજના ખૂબ પસંદ-ગીપૂર્વક થઈ હોય તો પ્રજા જેતનેતાંમાં ચડે. જ્ઞાનો જમાનો આજે હાત તો લોકો અંથપાલને મિત્રવર્ય તરીકે સંઝોધત.

—કાકા કાલેલકરો.

૧૦ માત્ર શાળાઓથી જ પ્રજા કાંઈ કેળવાઈ જતી નથી. શાળાઓ તો કેળવણીનું પ્રથમ એ ગ છે. જ્યા સુધી વિધાવધ જાતનાં પુસ્તકો પ્રજાને વાચ્યવા તથા મનન કરવા માટે મળે નહિ, ત્યાં સુધી પ્રજાને મળેલું અક્ષરજ્ઞાન વ્યર્થ છે.

૧૧ શાળાઓ અક્ષરજ્ઞાન આપીને કાર્યની શરૂઆત કરે છે. તે કાર્ય પુસ્તકાલયો અને વાચનાલયો દ્વારા પ્રજામાં સ્થાયી અને સુરક્ષદ થાય છે. પુસ્તકાલય પ્રવૃત્તિ એ કેળવણીનું એક અતિ આવસ્થ્યક અંગ છે.

—કંવરજ ગોનાયક,

૧

૧૨ નેતરની સોટી વગર કે ચાણુક વિના પણ પુસ્તકો આપણા ગુરુ થઈ ઉપદેશ આપી શકે છે. તેઓ કડવાં શુકન ઉચ્ચારતાં નથી, તેમ શિક્ષણુની પ્રી ભાગતાં નથી. તેઓની પાસે જાઓ, તો મહેતાળની માઝક તેઓ અગાસાં કે જોકાં ખાતાં નથી. તેઓને કોઈ પણ ગુપ્ત માહિતી પૂછશો, તો તેઓ કંઈ પણ સંકેત રાખ્યા વિના તે કહી ઢેશો. તમારી ભૂલ પડશો તો તેઓ મશ્કરી કરશો નહિ. તમો અનાડી જણુશો તો પણ તમારી હાંસિ તેઓ કરશો નહિ.

૨

૧૩ પુસ્તકો ખરાં ખરસમણ્ય છે. તમારી પાસે સારાં પુસ્તક હશે, તો તમને દ્વિલોજન મિત્ર, શુલેચ્છક મુરખ્યી, સલાહકાર અને દ્વિલાસો આપનારની એટ જણુશો નહિ. કોઈ પણ ઝતુના રંગમાં કે દશાના દર્ગમાં પુસ્તકો. તમારા દ્વિતીને આશાએશ જ આપશો. ઈતિહાસનાં પુસ્તકો વાંચ્યાથી માથા ઉપર સ્કેન પળીયાં આઠ્યા વગર ચેદેરા ઉપર કરચલી પડયા વગર યુવાનીમાં પુખ્ખ પ્રૌઢતા પ્રાપ્ત કરી શકય છે. કાઠની સાથે વિનોદ કર્યાથી વૃદ્ધ પણ યુવાન બને છે. આ અલિ-હારી પુસ્તકાલયોની છે.

૩

૧૪ પુસ્તકાલય એ એક મહાન પૂજનીય સરસ્વતી મંદિર છે. શૈના ઉપાસકો એ ખરા પૂજય દ્વિજ ગણુલા જોઈએ. આપણું હિં-હશાલ્ પ્રમાણે આદ્ધારેણું જ માત્ર દ્વિજ માન્યા છે. એટલે તેઓ એ વાર જન્મેલા-એક વખત જન્મકાળ પ્રસંગે અને બીજુ વખત ઉપર્વીત ધારણું પ્રસંગે પુનર્જીન-મ પામેલા-ગણુલાય છે. અંગ્રેજુ મહાન કવિ કીટસના એક કાવ્યમાં, કે જેમાં એણે મહાન થીક કવિ હોમણી આરાધના કરી છે, તેમાં એણે કવિઓને દ્વિજ ગણુલા છે. તેઓનાં કાંયો અને રસિક પુસ્તકો અમર રહે છે. અને તે કાંયો જ્યારે જ્યારે વંચાય લારે લારે તે કવિઓ માનસજન્મા બની, તેમની કદ્વપનાની કૃતિઓનો ઇરી ઇરી જન્મ થતો સુંદર રીતે કલાયો છે. આ પ્રમાણે ગણુતાં, પુસ્તકાલય તો દ્વિજને બદલે અનેકજ ગણુલાયઃ એટલે કે મહાન પુરુષોના અનેક વેળા જન્મ થવાનું તે સુવાવડખાનું અગ્ર માનસિક પ્રસૂતિગૃહ છે. એ કદ્વપનાથી પણ પુસ્તકાલયો એટલે જગન્નાની સુરસ્વતીનાં મંદિરો એમ ગણી આપણું પૂજયલાવ તેમની તરફ વધવો જોઈએ.

—સર મનુલાઈ.

૧

૧૫ પુસ્તકાલય એટલે જ પ્રગતિ; પ્રગતિનો વિચાર હુમેશાં પ્રગતિમાન હોય; એ વિચારને અંત ન હોય.

૨

૧૬ નિશાળનું કાર્ય પૂર્ણ થાય ત્યાંથી જ પુસ્તકાલયનું કામ શરૂ થાય. જ્ઞાનમાર્ગ આપણે ખુલ્લો કરવાનો છે. એ જ્ઞાનમાર્ગ જેમ બને તેમ વધારે માટ્ઠો રહે એ હર હુમેશ આપણે યાદ રાખવાનું, અને એ જ્ઞાનયાત્રામાં વધુ ને વધુ જાત્રાળુંએને નિમંત્રણ કાઢ્યા કરવાનું છે.

૩

૧૭ લોકશાસનના આ જમાતામાં લોકોએ ખરેખર કેળવાવું જોઈએ. તાલીમ વગરની પ્રજા કોઈ પણ જતના અધિકાર કે હક્કે માટે લાયક ન હોઈ શકે. શિક્ષણ કાંઈ નિશાળેથી સમાસ થઈ ની જાય; તેમ વ્યવસાયમાં પડ્યાથી તેનો અંત પણ ન આવવા હેવો જોઈએ. જ્ઞાન હુમેશાં વધારવું જોઈએ; જ્ઞાનને કોઈ જતની સીમા નથી. દિઝિમર્યાદા વિશાળ હોય તો જ સત્યનું શોધન થઈ શકે. એક સત્ય પછી બીજું સત્ય એમ પરંપરા લાધતી જાય, ને આપણું જ્ઞાન કસોટીએ ચઢતું જાય: આમ જ જીવન ઉદ્ઘાત બનતું રહે.

૪

૧૮ પુસ્તકાલયોથી સત્યયુગ આવી જ શો એમ હું કહેતો નથી; પરંતુ તેનાથી મનુષ્ય માત્ર વધારે ઉદ્ઘાર, વધારે જ્ઞાનસંપત્તિવાળો અને વધારે સંતોષી અને તેટલા માટે વધારે સુખી જરૂર થવાનો. પુસ્તકાલયની અંદર તેને સારી દુનિયાની મહાન વિભૂતિએનું ઓળખાણું થવાનું, અને ભૂતકાળના અને વર્તમાનના સંતોનો સમાગમ લાધવાનો; તો પછી એનું ચારિય સુધર્યા વિના કેમ જ રહે?

—મહુલાલ હુ. કંદ્યાવાળા.

૧

૧૬ આજના જમાનામાં નિરક્ષરતા અને અજ્ઞાન અસાધ્ય છે. ગામડે ગામડે ને જુંપડીએ જુંપડીએ જ્ઞાનનો કીપ પ્રગટાવવાનો છે. જ્ઞાનનો પ્રચાર એ જ આપણો મહામંત્ર હોવો જોઈએ; કારણું કે એ તો સ્પષ્ટ છે કે સાંસારિક અને નૈતિક અવનતિ અને ફુષ્ટતા ઈત્યાદિ જ્ઞાનના દીપથી જ નાશ થઈ શકશે. ને ખુદ્દી ખીલશે, આત્મજ્ઞાન પ્રગટશે, તો સ્વાશ્રય અને સ્વાભિમાન આવશે, અને તેજ ખર્દું મનુષ્યણા છે. આ અર્થે સિદ્ધ કરવાનાં એ સાધનો છે: શાળાએ અને પુસ્તકાલયો.

૨

૨૦ પુસ્તકાલય એ માત્ર નવરાશનો વખત ગાળવાનું સ્થળ નથી, પણ એક પ્રકારનું વિશ્વવિદ્યાલય છે. પુસ્તકાલય એ માત્ર શ્રોધની વસ્તુ નથી, એ કંઈ સંસ્કૃત વર્ગ માટે કે સાહિત્યકારો માટે જ નથી, પરંતુ એ તો વિશાળ જનસમાજના લાભાર્થે છે; અને એ રીતે શિક્ષણુનો ભણોળો પ્રચાર કરવા માટે છે. પ્રાથમિક શાળામાંથી નીકળીને આગળ વધવાનું એ એક પગથિયું છે.

૩

૨૧ આજે નવી પરિસ્થિતિને અનુકૂળ વર્તવાનું છે. આપણું લાઇઝેનોનો અજ્ઞાનના ખાડુંનાંથી ઉંડાર કર્યા સિવાય એક પગલું પણ પ્રગતિને કંથે જઈ શકાશે નહિં: અને એટલા માટે જ તો જનસમૂહાયનું શિક્ષણું, હાથમાં લેવાનું છે અને તે શાળા અને પુસ્તકાલય દ્વારા જ થઈ શકશે. બાળકો સાથે મોટી વયના કામદારીને પણ શિક્ષણુની જરૂર ધણી જ છે.

૪

૨૨ શાળાનો ઉમરો ઓળંગીને પુસ્તકાલયમાં પગ મૂકાય ત્યારે જ કુરન્યાત શિક્ષણનાં ખરાં સારાં કૂળ આવે. પુસ્તકાલય જીવન પર્યાતની શાળા છે; શિક્ષણનું મોટામાં મોટું સાધન છે. બ્લોકોને અક્ષરજ્ઞાન આપીને પછી તેનાં હથિયાર ન આપવાં એ રો જંલીર ભૂલું છે, બદ્દકે પાપ છે.

—સૌ. શારદા મહેતા, ખી. એ.

૨૩ “ પુસ્તકાલય એ એશાઓરામની વસ્તુ નથી; એ થોડા સંસ્કૃત માણુસો માટે નથી; એ કેવળ વૈજ્ઞાનિકો માટે નથી; એ કોઈ ખુદ્ધિવાળા સંપ્રદાય કે એક જ કોઈ સાહિત્યિક સમૂહાય માટે નથી: એ મહાન, વિશાળ, વ્યાપક, સાર્વજનિક શ્રેય સાધનાર સંસ્થા છે. એ આખી જનતાને ઉંચે ચઢાવે છે; એ પ્રજાના ખુદ્ધિક વિકાસનું ખરું શક્ય છે; એ લણેલાંને તેમની જરૂરિયાત પૂરી પાડે છે તથા કેળવણી માટેની વ્યાપક એવણા પૂરી કરે છે. શાળાઓને, તે ઉપલો માળ છે; અને પરિપક્વ વિક્રાનો માટે એમની ઉંચી વિકસિત શક્તિઓના વધુ વિકાસનું ક્ષેત્ર છે. એથી આગળ જે અનેક ભાગક ખાલિકાઓને શાળાનું પદ્ધતિસર શિક્ષણ નથી મજજું તેમની કેળવણી અને સંસ્કારિતા માટેનું એ સરસ સાધન છે.”

‘ પુસ્તકાલય, લાલ લેનારની સામાન્ય ખુદ્ધિનો વિકાસ કરે છે; નૈસર્જિક, કળામય અને રસિક વૃત્તિને ખીલવે છે; ચાલતા ચુગની શાખીય પદ્ધતિસર વિચાર કરવાની શક્તિ પોતે છે; લોકના ‘નાગરિક જીવન’ ને પવિત્ર અને ઉજ્જીવ બનાવે છે; ગૃહ, શાળા, ધર્મ મંદિર અને રાજદરખારના કાર્યને મદદગાર થઈ પડે છે અને કેળવણી, ધર્મ તથા રાન્યના જીવનમિત્રની ગરજ સારે છે. જેઓ પુસ્તકાલયને ચોંધે છે તેઓની ગણુના, દેશનું હિત સમજનારા, પ્રજાનું કલ્યાણ જેના હૃદ્યમાં રમી રહ્યું છે એવા, અને માનવજાતનું લવિષ્ય જેના હાથમાં છે એવાની સાથે થવા ચોંધ્ય છે.”

—પ્રો. કુંવરજી ગો. નાયકના પેટલાદના ભાષણમાંથી.

૨૪ તમે એમ સમજતા હશો કે અનુભવથી મેળવેલું જાન પુસ્તકો દ્વારા મેળવેલા જ્ઞાન કરતાં વધારે સંગીન છે, તો તે તમારી ભૂત્ય છે એમ હું કહીશ. કારણ કે પુસ્તકમાં લખાયલું જાન તે પણ કોઈએ અનુભવથી મેળવેલું જ છે. જેટલું જાન તમે તમારી હુંકી જીહગીમાં મેળવી શકશો, તેટલું જ જાન થોડા કલાક એક ચોપડી વાંચવાથી તમે મેળવી શકશો. બીજાં ઘણું માણુસોના અનુભવનું જાન તમે લઈ શકશો. અને તેથી તમને પોતાને અનુભવ દેવાનું વધારે સહેલું થઈ પડશો.

—શ્રીમંત સંપતરાવ ગાયકવાડ.

<sup>૧</sup> ૨૫ પુસ્તકાલયો શુરૂતું કામ સારે છે, અને ઉપયોગ કરતાં આવડે તો તે જીવતા શુરૂ કરતાં વધારે સાર્દું કામ આપી શકે છે. કોઈ જીવતા શુરૂમાં વિક્રિતા વધારે હોય તો પણ તે જીવતાં સુધી બીજાને લાલ આપી શકે; પણ પુસ્તકાલયમાં તો હજારો વર્ષનું જ્ઞાન ભરેલું હોય છે, અને જે માગે ને કે ઈચ્છે તે તમામને સંકેત વિના, લાલચ વિના, ગુસ્સે થયા વિના અને થાક્યા વિના આ અશરીરી શુરૂઆત અમોદ જ્ઞાન આપે છે. એક છેકરાને માટે જેટલી શાળાની જરૂર છે તેથી વધુ જરૂર સારાં પુસ્તકોની છે.

<sup>૨</sup> ૨૬ જ્ઞાન પ્રાપ્તિ માટે પુસ્તકાલયો છે. પણ પુસ્તકાલય સંયહથી જરૂર જ્ઞાન મળતું હોય તો હું જ્યાંથી સેંકડો પુસ્તકો ખરીડું છું. તે તારાપોરવાળા કે થેકરની ફુકાનો પણ પુસ્તકાલય કહેવાય !

<sup>૩</sup> ૨૭ પુસ્તકોના વાચનથી જ્ઞાન મળી શકે ને બુદ્ધિ ભીલે પણ એકલી બુદ્ધિ ચારિત્ર ન ધરી શકે. વાચનમાંથી એંચેલો નીચોડ હમેશાં લઈ તે પ્રમાણે વર્તવાની ટેવ પાડે તો જરૂર ચારિત્ર ધરાય.

<sup>૪</sup> ૨૮ ગમે તે માણુસ ગમે તે લખે અને લોકોને ઝાવે તેવું વાચન પૂરું પાડે અથવા વાંચવા દેવામાં આવે તો તેથી સમાજની મનોદૃશામાં અનિષ્ટ જેર લેળવ્યા જેવું પરિણામ આવશે. તેવું જેર કોઈ જાણે અજાણે રેડી જાય તે અટકાવવું હોય, તો ઉપયોગી જ્ઞાન આપે એવાં સારાં વાચનનો લોકોમાં શોઅ ફેલાવવો.

<sup>૫</sup> ૨૯ હું માણુસ છું; બીજાની સેવા કરવી એ મારો ધર્મ છે: તે સમજવું એનું નામ માણુસાઈ છે, અને એવી માણુસાઈ પુસ્તકાલયમાંથી મેળવવાની છે. પુસ્તકાલયો શુરૂતું કામ સારે છે તે ખરૂં છે. પણ તે સાર્દું હોય અને ઉપયોગ કરતાં આવડે તો તે જીવતા શુરૂ કરતાં વધારે સાર્દું કામ કરી શકે છે. કોઈ જીવતા શુરૂમાં કદાચ વિક્રિતા વધારે હોય તો પણ તે જીવતાં સુધી બીજાને તૈનો લાલ આપી શકે. પણ પુસ્તકાલયોમાં તો હજારો વર્ષનું જ્ઞાન ભરેલું છે, અને જે માગે, જે ઈચ્છે તેને સંકેત વિના, લાલચ વિના, ગુસ્સે થયા વિના અને થાક્યા વિના આ અશરીરી શુરૂ અમોદ જ્ઞાન આપે છે. એક છેકરાને માટે જેટલી સારા શિક્ષકની જરૂર, તેથી વધારે જરૂર સારા પુસ્તકાલયની છ.

—સર મલાશાંકર પદ્ધાંહી.

૧

૩૦ પુસ્તકાલયો, વાંચવાની અભિરુચિ તુસ કરે છે અને સાથે સાથે અભિરુચિ ઉમજ પણ કરે છે; એટલે કે કાર્ય અને કારણ એમ ઉલય રૂપે લાભદારી છે. એટલે દરેક શાળાને અંગે નાનું સરખું પણ પુસ્તકાલય હોય એ જરૂરનું છે.

૨

૩૧ જેટલી જરૂર આપણા શરીરને ખોરાકની છે, તેટલીજ આપણા મનને જ્ઞાનની છે: અને તે જ્ઞાન મેળવવા સારુ દરેક જણુ પુસ્તક વસાવી ન શકે, વસાવવાની ઢંઢા અને શક્તિ હોય તે સંચણી ન શકે, સંચણી શકે તે બહાર બીજાને આપવાની વ્યવસ્થા ન કરી શકે, માટે એ સર્વ કરી શક્ય તે સારુ પુસ્તકાલયો જ જોઈએ; અને તે સાર્વજનિક તેમજ બનતાં સુખી 'ફી' હોવાં જોઈએ.

—દેડી વિદ્યાગૌરો નીલકંદ.

૩૨ પ્રજા વર્ગને જીવનમાં ઉપયુક્ત વિદ્યા અને કલાનાં વિવિધ પ્રકારનાં જ્ઞાન વિજ્ઞાનની ખોટ પૂરી પાડવી અને તેમને ઉત્તરોત્તર અભ્યુદ્ય માર્ગ પ્રત્યે આગળ લઈ જવા માટે જોઈતી માહિતી પુસ્તકના રૂપમાં પૂરી પાડવી એ એક બજા વિધિ છે.

વાચક વર્ગને પુસ્તક સંચહના વાચન માટે આકષ્યવો તેનું વ્યસન કર્યાદી હેતું, તેમાંથી સાર પ્રકૃષ્ટ કરવા સમર્થ કરવો અને એ ચારને અનુભવમાં ઉતારી લઈ સમાજના કલ્યાણ અર્થે અનુભવનું કર્યા પ્રગટ કરીને તેનો પ્રસાર કરવો એ જ આ યજનો પ્રાણ છે. એ ભાવનાના અરિતત્વ ચિવાય પુસ્તક સંચહે ઉધાર્ણના બોજન રૂપે પરિણામ પાને અને પ્રજાસમૂહ ઉત્તરોત્તર સ્વકર્તાવ્યપથમાં આગામ વધવાને ગાદલે દિવસે દિવસે હીન દશાને પામે.

—શેડ પુરુષોત્તમ નિ. માવળ.

૧

૩૩ રજયનું ગૌરવ તો નાનામાં નાના ગામડામાં આ વિધા-  
મંદિરની સ્થાપનામાં રહેલું છે. ગરીબ ગામડીઓની સ્થિતિ આપણે  
ત્યાં કે અન્ય સ્થળોન્યાં જેશો ત્યાં ઘણું જ શોચનીય માલમ પડશે.  
એનો ખોજો અસહ્ય હોય છે. ગામડીઓની વેહના જાણવા શહેરના  
નાગરિકોને કંઈ પડી નથી. ગામડીઓ તો શ્રીમંતોની ધનદાલસાથી  
તેમ સ્વતંત્રતાના વાંચ્છુઓના ચિત્ર વિચિત્ર પ્રયોગાથી બિચારો  
કર્યાયદો જ રહે છે. એનો એલી ઈશ્વર જ હોય. આપણે એનો  
હાથ સહાવો છે, એનાં જ્ઞાનચક્ષુ ખોલી એની સ્થિતિ સુધારી એને  
તારવો છે, પુસ્તકાલયોની ખરી ઉપયોગિતા હું એમાં જોઉં છું.

૨

૩૪ પુસ્તકાલયનો આત્મા તો “લાઇફ્રેરીયન” જ હોય. કુશળ  
વિદ્ધાન લાઇફ્રેરીના વિના પુસ્તકાલય હમેશાં નિર્ણય ખોખું જ  
હોઈ શકે. લાઇફ્રેરીના કાર્યના અનુભવ સાથે એ કામ કરનારની  
પોતાની ક્રરજ પ્રત્યે એકનિષ્ઠા એ અતિ આવશ્યક છે. તે પુસ્તકના  
સંશોદસ્થાનનો રક્ષક માત્ર જ ન હોવો જેઠું. પરંતુ જાતે વિદ્ધાન  
હોવાની જરૂર છે. એનું કાર્ય પ્રોફેસરોના કરતાં એછું સંગીન નથી  
હોતું. સખત કાયદા વાપરવા કરતાં ઉદારતા અને આંખ આડા કાન  
કરવાની જરૂર જણ્યાય, ત્યાં તેવી રીતે નિયમોનો અર્થ કરી લાઇફ્રેરીનો  
વ્યવહાર ચલાવવાની જરૂર છે.

—સુભંતરાય હુકમતરાય હેસાઈ.

૩૫ લોકો આપેલું શિક્ષણ ભૂલી ન જાય, તેમને આપેલું માન-  
સિક દ્રોય તેઓ સાચવો રાખે અને તેમાં વધારો કરે, પોતાની  
જવાબદી સમજતાં શીખે અને છેવટે એ ભાર પોતાને જ માથે  
લઈ લેવાની ચોંયતા સમજતા થાય—એ ઉદેશથી પુસ્તકાલય  
પ્રવૃત્તિનો આદર થયો છે.

—મણિલાલ લલખુભાઈ પરોખ,

૧

૩૬ જેમ રોટી વિનાનું શરીર કૃશ થઈ થઈને છેવટે નકારું થઈ જાય છે, જ્ઞાણી જેઠિને ભૂખે મરનાર જેમ આત્મહત્યા કરે છે; તેમજ જ્ઞાન વિના ચૈતન્યદેહને ભૂખે મારનાર પણ આત્મધાત જ કરે છે. “આત્મધાતી પુરુષો અસ્રૂય અધત્તમસ્તાવૃત લોકમાં જાય છે.” એ ઉપનિષદનું વાક્ય તેને પણ લાગુ પડે છે, કદાચ તેને જ વધારે લાગુ પડે છે.

૨

૩૭ સામાન્ય બ્યવહારમાં જેમ સાધનોના જ્ઞાનની જરૂર છે, તેમ માનવ સ્વલ્લાખ જાણુવાની, તેની શક્તિ અને શક્તયતાના જ્ઞાનની, અને તેની ઉપરની જ્ઞાનજ્ઞન્ય આસ્થાની પણ એટલી જ જરૂર છે. આપણાં નેવું ટકા હુંઝો તો માણુસ માણુસને સમજતું નથી રેથી જ ઉલાં થાય છે : તે સર્વ ફૂર કરવાને જ્ઞાનની જરૂર છે.

૩

૩૮ દરેક પુસ્તકાલયમાં દરેક વિષયના પુસ્તકો હોવાં જેઠિએ. અમુક વિષયના વાંચનારા એણા છે માટે તેવાં પુસ્તકો ન હોવાં એ દલીલ ખોટી છે. જ્ઞાનની આખત માગ અને ઉત્પજ્ઞના અર્થશાસ્ત્રના નિયમ ઉપર છોડી શકાતી નથી. અમુક શાસ્ત્રીય જિજ્ઞાસા ન હોય તો અનેક સાધનોથી તે ઉલ્લિટી ઉત્પજ્ઞન કરવી જેઠિએ. હલકા સાહિત્યની ખપત વધારે છે એ એવું સાહિત્ય લેવાને લેશ પણ કારણ નથી. જિજ્ઞાસા તૃપ્ત થવાને પથ્ય પુસ્તકો હોવાં જેઠિએ.

૪

૩૯ ‘નહિ પાણી કરતાં એરવાળું પાણી પણ સારું’ એ જે ખરું હોય, તો જ ‘નહિ વાચન કરતાં ખરાબ વાચન સારું’ એ ખરું કહેવાય.

— રામનારાયણ વિ. પાઠક.

૧

૪૦ પુસ્તકાલયનું મહત્વ કોઈને અજણ્યું નથી. પ્રજાની પ્રગતિ તેના સંસ્કારથી મપાય છે. એ સંસ્કારનું પ્રતિબંધ પ્રજાના સાહિત્યમાં પ્રજાના વાર્ષિક્યમાં જીવાય છે. એ પ્રતિબંધને પુસ્તકે સંબંધે છે, અને રક્ષે છે—પછી તે પુસ્તકે શીલા ઉપર કેતરેલાં હોય, તાડપત્ર ઉપર લખાયાં હોય કે સર્કારીદાર કાગળ ઉપર છપાયાં હોય; અને એવાં પુસ્તકેનો સંબંધ એ આપણા સંસ્કારનો હોય; અને એવાં પુસ્તકેનો સંબંધ એ આપણા સંસ્કારનો સંબંધ બની જાય છે. પુસ્તકાલય એટલે પ્રજાસંસ્કારનો ભંડાર !

૨

૪૧ પુસ્તકાલય એ એક એવી સમદર્શી સંસ્થા છે કે તેમાં ક્લી કે પુરુષ, બાળક કે વૃદ્ધ, પ્રાણીશુદ્ધ કે અધ્રાણીશુદ્ધ: એ સર્વનો સરખો સમાસ થઈ જાય. એ એક મહા પવિત્ર અને પૂજનીય શારદામંદિર છે.

૩

૪૨ પુસ્તકાલય વગર પ્રાથમિક કેળવણી તો નિષ્ઠળ જ નીવડે. વળી, શાળાઓ અને પાઠશાળાઓ વિદ્યાર્થીને અસુક ભૂમિકાએ પહોંચાડ્યા પછી તેને સંઘરતી નથી; ત્યારે પુસ્તકાલય તો વિદ્યાર્થીની જીવન જરની પાઠશાળા છે.

૪

૪૩ પુસ્તકાલય વગરનું ગામ એટલે હોક્યાંત્ર વિનાનું વહીણું. ને પ્રજાને નિત્ય બનતા બનાવેાની ખખર નથી તે પ્રજા આગળ વધી શકતી નથી. ને પ્રજા અલણું છે તે પ્રજા અંધકારમાં છે. ઉદારમાં ઉદાર રાજ્યખારણું તળે પણ અજ્ઞાન પ્રજા તો અંધનમાં જ રહેવાની. એ અજ્ઞાન-એ અસણુપણું-નાખુદ કરવું એ એકલો રાજ્યમાં છે એમ જ નહિ; એ તો એક મહાપુણ્યનું કાર્ય છે.

—રમણલાલ ન. દેસાઈ,

૧

૪૪ પુસ્તકાલય તો તે જ કે જેના પ્રમાણે ગામજાંથી જેર, વેર અને કુસંપ ફૂર થાય, ભાઈચારાની લાગણી વધે, કેળવણી અને શાનની વૃદ્ધિ થાય, મનુષ્યને મનુષ્યત્વનું લાન થાય, અને ખાલક, ઝી, ચુવાન તેમ વૃદ્ધને તેની ફરેક પ્રવૃત્તિમાં પોષણ મળે.

૨

૪૫ આપણી સામે આપણી ક્રરંજે અને જવાખારીએનો ઢગદો પડેલો છે. પુસ્તકાલય એ એવા ઢગદાને પહોંચી વળવાની ચાવી છે. તેને હું અલાહીના દીવાની ઉપમા આપું છું અને એ દીવો એક વખત સાધ્ય થયો કે પછી તમે જે તેની પાસે માગશો તે તમોને આપોઆપ જરૂર મળી રહેશે.

૩

૪૬ ગરીએને અજની મહદૃ કરવાને માટે સદાવતો રાખવાની આપણી પ્રથા ધણી જુતી છે અને તે હજુ આપણે રાખી રહેલા છીએ. પાણીની તરસ મટાડવાને માટે ગામેગામ અને રસ્તે રસ્તે આપણે ત્યાં પરબો ઉધાડવામાં આવે છે; પણ આત્મતત્ત્વ અને શરીર-તત્ત્વ એ બંનેના પોષનારા આ શાનનાં સદાવતો કે શાનની પરબો ગામેગામ અને મહોદ્વલે મહોદ્વલે નીકળવાની જરૂર છે.

૪

૪૭ પુસ્તકાલય એ વર્તમાન તથા ભૂતકાળને એક કરી નાપે છે. કાલાઈદ જેવા સમર્થ વિદ્ધાને વર્તમાનકાળને ભૂતકાળનો સરવાળો કહેલો છે. જ્ઞાનમંહિરના આ મહાસાગરમાં મનુષ્ય જીવનનાં અનેક પ્રકારનાં શાનની નદીએ એકઠી થાય છે. સાહિત્ય, પ્રીતસુધી, વિજ્ઞાન, ધર્તિહાસ, સ્થાપત્ય, કાવ્ય, નાટકો વગેરે વગેરે અનેક ભાખતોમાં મનુષ્યે ભૂતકાળમાં મેળવેલું શાન પુસ્તકાલયમાં તમારી સાથે પુસ્તકો રૂપે ઉલેલું હોય છે.

૫

૪૮ જેવી તમારી અભિરૂચિ તે પ્રમાણે પુસ્તકાલયમાં તમને જ્ઞાન મળી શકે છે. આપણા પ્રાચીન ઋખિભુનિથી માંડીને ત્યાં દરેક દેશના સમર્થ વિદ્ધાનો અને શ્રીલસુદ્રાને તમે વિના સંક્રાંતી મળી શકે છો. પુસ્તકાલયોમાં વણ્ણબેદ કે જાતિસેદ, જેવો જીવતા મનુષ્યોમાં જોવામાં આવે છે, તેવો હોતો નથી. શેકસ્પીઅર સાથે કાલિદાસ અને પ્રેમાનંદ ભાતૃભાવથી રહી શકે છે. આવું પુસ્તકાલય, તમારા સેવક તરીકે, તમે ચાહો તે વખતે તમારી નોકરી ખજાવે છે, મિત્ર તરીકે તમને સલાહ આપી શકે છે, ગુરુ તરીકે શિક્ષણ આપી શકે છે, તમારા પ્રતિપક્ષી તમારી સાથે વાદાર્થ પણ કરી શકે છે. તમે તેને માટે ગમે તે ભત બાધા તે બાખત તે ઉદ્ઘાસીન હોય છે. ઈતિવરના અંશ રૂપ પુસ્તકાલય છે, એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ થતી નથી.

—ધારુલાલ ધ.

૪૯ જગતમાં જે સ્થાન ગુરુઓને આપી શકાય છે અને અપાવું જોઈએ, તેના કરતાં જરા પણ ઓછું નહિ એવું સ્થાન અંથપાદોનું છે. માતૃદેવો ભવ | પિતૃદેવો ભવ | આચાર્યદેવો ભવ | એ ભાવના સાથે ગ્રંથપાલદેવો ભવ | એ ન ઉમેરોએ ત્યાંસુધી એ વાક્ય અપૂર્ણ રહે છે. ખરે અંથપાલ ખરા ગુરુની પેઠે અનેક આકર્ષણું રહ્યી તેને પુસ્તકાલયો પ્રતિ આકર્ષી શકે. —હરિલાલ ગો, પરીખ.

૫૦ પુસ્તકાલયોમાં વધુ પુસ્તકો વંચાય તેમાં ઈતિકર્તવ્યતા નથી. લદ્દે એછાં વંચાય પણ સારાં વંચાય તો જ લાલ છે; નહિ તો હાનિ છે.

—પ્રતાપરાય ગિ. મહેતા.

૫૧ પ્રાચીન સમયમાં ખ.લણેણું જગદ્વંધ ગણ્યાતા હતા. તે સમયમાં પ્રાણીણું એટલે જ્ઞાનની પરણો, વિદ્યાના લંડાર, જ્ઞાનના લંડાર, ચારિત્રના આદર્શ અને જગતમ તીર્થધામ (living travelling libraries) એ રીતે સંઘળી વાતોનો નિર્ણય તે પ્રાણીણું કાળના ખળે આજે આપણે એક્ષી ઉલટું જ જોઈ રહ્યા છીએ. તે વખતે પ્રાણીણું વગરતું કોઈ ગામ હોય જ નહિ, અને હોય તો તે સમશાનવતું જ મનાતું.

હું આજના જમાનામાં પ્રાણીણું સ્થાને અમૃત અંશો પુસ્તકાલય છે. એટલે કોઈ પણ ગામ પુસ્તકાલય વગરતું ન હોય જોઈએ. જ્યાં પુસ્તકાલય ન હોય એટલે જ્ઞાનની પરખ ન હોય તે ગામ સમશાનવતું જ મનાવું જોઈએ.

—નાનાલાલ ગિ. શાહ.

૧

૫૧ પુસ્તક અક્ષરજ્ઞાન માગે છે; એટલે પ્રજાનું કોઈ બાળક ‘અભિષ્ટ’ ન રહે તો જ પુસ્તકપ્રિયતા અને જ્ઞાનપ્રચાર કેળવાય. એ રીતે પ્રથમ શિક્ષક, પછી અક્ષરજ્ઞાન અને પછી પુસ્તક.

૨

૫૨ દરેક સાચું પુસ્તક એક એક વ્યક્તિ છે, એક એક સંસ્કૃતિ છે, એક એક નવી જીવિત છે. પુસ્તક બદલાતા હેઠાળનું પ્રતિબિંભ જીલે છે, અને જાળવે છે; એટલે અંશે પુસ્તક પ્રજાસમસ્તનો વહીવંચ્યો છે.

૩

૫૩ છ્યાય છે તે ખધાં પુસ્તકો છે એમ માનવાનો ભ્રમ ન કરીએ. પુસ્તકનું અનન્ય ગુણુત્ત્વ એના દેખકના સાત્ત્વિક, જ્ઞાન અને ગૌરવલય્ય વિચાર-અદ્ઘાર્ય પર અવલંબે છે.

૪

૫૪ પુસ્તકવાચનનો સંસ્કાર-કોઈ ધારે છે તેમ-કૃતા માદ્હક નથી. યોગ્ય વચ્ચે સાનુક્રૂળ પુસ્તક વાંચવા મળે તો લાંબિ જીવન પર તે સરસ રીતે અસરકારક નીવડે છે; એટનું જ નહિ પણ પ્રજાની મનોહરા સુદ્ધાં તે પદારથી શકે છે.

૫

૫૫ ધણું માતાપિતાએ, મિત્રો અને શુરુએ કરતાં વધુ સારી અસર પુસ્તકો પાડે છે. પુસ્તકમાં વડોલશાહી નથી, ર્વાર્થભાળ નથી અને સત્તાધીશપણું પણ નથી: પુસ્તકનું વ્યક્તિત્વ અતિ નામ અને નિરાણું છે.

૬

૫૬ પુસ્તકનું યાવિય સમજવાની હળુ આપણુને વાર હોય એમ લાગે છે. પુસ્તક તરફ સંમાનવૃત્તિ ઉપજશી, ચાહ વધશો, વાત્સલ્ય આવશે ત્યારે પુસ્તકને મેલું નહિ કરીએ, અવિવેકથી નહિ પકડીએ; ત્યારે પુસ્તકને ચોરીશું નહિ, કે એનાં પાનાં ઝડીશું નહિ; કોઈનું પુસ્તક રાખી દેવાના ઓટા દોબમાં ફ્રસાશું નહિ: પરંતુ એનો યથેચું ઉપયોગ અને નિયમિત આપદે શિખીશું.

૭

૫૭ પુસ્તકાલય ઘરનો શાણુગાર જ નથી પણ માનવ જીવનનું મહા ઉપયોગી અંગ છે. ત્યારે આપણાં પુસ્તકાલયો હાલ દીન, સુસ્તા અને અધ્યવસ્થિત દશા કેમ ખોગવે છે ?

૮

૫૮ પુસ્તકાલય પ્રજાની સ્થાવર-જ ગમ મિલકત છે—વારસો છે. એમાં પ્રજાગણુનો પ્રાણુ છે, ધર્તિહાસ છે; લોકદિલ્હિ અને લોકરિદ્ધિ છે.

૯

૫૯ નિરોગી ખોરાક અને સંસારધ્યવહારની ખીજુ જરૂરતો ઉપરાંત દરેક માનવ આત્માને યોગ્ય વયે યોગ્ય પુસ્તક મળી શકશે, ત્યારે જ સમાજખારણું દદ, સુખદ, અને ધ્યવસ્થિત બનશે.

૧૦

૬૦ રૂભ૦ કલાપી પુસ્તક ગ્રેમી તો હતા અરા; પણ પુસ્તકોના ખરેખરા લક્ત હતા. સંસારકલુધિત એમના જીવનની લાવના આ રહીઃ

‘ જીવિશ બની શકે તો એકલાં પુસ્તકોથી ’

૧૧

૬૧ વાચન એ નિર્દેખ, સુંદર ને શાન્ત પ્રવૃત્તિ છે. એવૈનીમાં કે ઉદાસીમાં, કામથી થાકીએ કે વિચાર કરોને કંટાળીએ ત્યારે વાચન મધુરો આરામ આપનાર બને છે. કપરી નિરાશાંની ઘડીએમાં પણ વાચન એવી તો ઉત્તેજના ને લાવના સીંચે છે, કે જે જીવનનું નતું ઘડતર કરે છે અને તેને નવેસરથી એખ આપે છે.

૧૨

૬૨ દરેક સંસ્કારી અને સુશિક્ષિત ઘરમાં સારા પુસ્તકનું પવિત્ર સ્થાન-સુધાર અને સુંદર પુસ્તકાલય-હાલું જ જોઈએ: મોટેરાને પોતાનું પુસ્તકાલય, કુમાર કન્યાને એમનું પુસ્તકાલય અને ખાળકને પાળકનું પુસ્તકાલય. શરીરને જેમ ઘર છે તેમ જ મનને એનું પુસ્તકાલય છે.

૧૩

૬૩ પુસ્તક [ત્રિકલાદુર્શી] અને લવિષ્યાતા છે. કોઈ ન જોઈ શકે તે દીધ પુસ્તકમાં છે. કોઈ ન સમજે તે રહસ્ય તેમાં છે. કોઈ નહિ હશે ત્યારે ય પુસ્તક હશે. કોઈ નહિ બોલે ત્યારે પુસ્તક બોલશે. પુસ્તક પ્રજાના ધર્તિહાસનો વહીવંચા છે અને પ્રારખનો જ્યોતિષી પણ છે.

—દેશાળુ પરમારો

૬૪ ઇરતાં પુસ્તકાલયો એ પણ એક આશિર્વાદાત્મક સંસ્થા છે. સારાં સારાં પુસ્તકો એ રીતે દેશને ખૂણે ખૂણે ફરી વળે અને ગ્રનને ઘેર એઠાં તેનો લાલ મળે, એ કેળવણીને માટે કેટલું ખંડું ઈંદ્ર છે? ગ્રનને એકલા અક્ષરરશાનનો થાડો જ ઉપરોગ છે. અક્ષરરશાન પછી જો ઉંચા પુસ્તકો તેને પૂરાં પાડવામાં ન આવે તો એ અક્ષરરશાન નિરથી કંઈ નીવડે છે, અગર છેક ભૂલી જવાય છે. ઇરતાં પુસ્તકાલયો, તેટલા માટે ગ્રનની જગ્ગાની મહત્વનો હિસ્સો આપી શકે છે.

—લા. કા. લાટે.

૬૫ આપણે ત્યાં સંતતિ વગરના ધનાદ્ય લોકો પોતાની હૃતિમાં જ અગર વસીયતનાસું કરી પોતાની સ્થાવર જંગમ મિલકત ઢાકમાઠથી રહેનાર અને મોજમજણું ઉડાવનાર પોતાના ધર્મગુરુને અર્પણું કરી હે છે, અગર પોતાની પાછળ ન્યાતો! કરવામાં, લહાણું કરવામાં અગર તેવા થીઓ બિનજરૂરી કામેભામાં ખર્ચાવી નાખે છે; તેને બદલે આજના સમયમાં જનસમાજનું ખર્ચ કલ્યાણ કરનારી પુસ્તકાલય, શાળા, કે દ્વારાનાની સંસ્થા ઉધાડવા કે ચાલુ હોય તેને મદદ કરવાને આપતા હોયતો તેમના ધનનો સહૃદયોગ થાય એટલું જ નહિ પણ તેમનું નામ પણ અમર રહે. પરિણામે કોઈ ગામ લાગ્યેજ એવું રહે કે જ્યાં સારું અને સગવડનાળા મકાન સાથેનું હૈનિક, માસિકો અને ઉપરોગી પુસ્તકોથી લરપૂર પુસ્તકાલય થયું ન હોય.

—રા. ખા. ગોચિંદલાઈ હા. દેસાઈ.

૬૬ વાચનતું સુખ ધણું પુસ્તકોથી નહિ પણ ધણુા વાચનથી જ પ્રાપ્ત થાય છે. નિત્ય નિયમપૂર્વક પ્રાર્થનાના જેટલી જરૂર છે, તેટલીજ નિત્ય અધ્યયનમાં આગળ વધવાના પણ ખાસ આવશ્યકતા છે. અતિથિઓને — મિત્રોને હું ધણું પુસ્તકો બતાવીને તો નહિ પણ ઉત્કૃષ્ટ પુસ્તકોની સાથેનો મારો ગંભીર પરિચય બતાવીને આનંદ આપી શકું, અને ચોંચ ભાગો દેખાડીને મારાં થોડાં પુસ્તકોમાં પણ વાંચવાનું ધણું છે એની પ્રતીતિ કરવી શકું.

—મહાશિંદ્ર રળણ ભક્ત.

૬૭ એક નાનું પણ વિવેકથી એકઠી કરેલી આપડીઓનું પુસ્તકાલય એ જ આપણું ખરું વિશ્વવિદ્યાલય છે. આપણી શાળાના ગુરુઓ તો કહેવાતા ગુરુઓ હોય છે. તેમના શિક્ષણું કરતાં પણ વધારે ઉંચું શિક્ષણું આપણને કોઈ પુસ્તકમાંથી મળ્યું તો આપણે એ પુસ્તકના લેખકને જ આપણો ખરે ગુરુ માનવાના. આવા અનેક ગુરુઓનો સમાગમ હાલના સમયમાં એક પુસ્તકાલયની મહદ્દી કરી શકાય છે. કાર્યાદીને યોગ્ય વિચાર દર્શાવ્યો છે કે:—

‘પુસ્તકાલય એજ આપણું વિશ્વવિદ્યાલય છે’

—અ. ક. વિવેકી.

અદ્ભુતિ શુદ્ધાન્ત મનો જ્ઞાનેન શુદ્ધાન્ત ।

૬૮ શરીરના અવયવો જળ વડે સ્વચ્છ થાયાં છે, તેમ મન જ્ઞાન વડે શુદ્ધ બને છે.

અને આવું જ્ઞાન ઉત્તમ અંથોનાં વાચનને જ આભારી છે. એવાં પુસ્તકો ગરીબમાં ગરીબ પણ મેળવી શકે એટલા માટે પુસ્તકાલયો એટલા પ્રમાણુમાં વિશેષ ખુલે તેટલું વધારે સારું. પુસ્તકાલયને આપણે જ્ઞાનસત્તની ઉપમા કાં ન આપીએ? કારણું કે અજ્ઞાનથી તો ક્ષણિક તૃતીય થાય છે, ત્યારે જ્ઞાનસત્તની મતુધ્યને ચિરસ્થાયી તૃતીય મળે છે.

—ગોસ્વામી શ્રીવિદ્ધિભલાલાજ.

૬૯ અવન હુંકું છે, વ્યવસાય ધણો છે ને તેમાં વાચનનો સમય વાચનસામન્યીની સામે નજર કરતાં થાડો છે. માટે પસંદ કરી કરીને વાંચવું.

—ગિજુલાલ.

૭૦ અ. જમાનાના જ્ઞાન દીતા ગુરુઓ તે પુસ્તકો: આવા ગુરુ-ઓનાં ગુરુકુળો તે સુંદર પુસ્તકાલયો: અને તેઓ ગુરુકુળોના ઉત્સવ તે પુસ્તકાલય પરિવહ અને પુસ્તકાલય પર્વણીના દિવસો!

—હરભાઈ વિવેકી,

૧

૭૧ આજના જમાનામાં જીવવા માગનારને માટે વાચનાલય અને પુસ્તકાલયનો લાભ એ જીવનની અનિવાર્ય બાળત થઈ પડી છે. જાતે જીવનું હોય ને દેશને જીવાડવો હોય, તો તો હુનિયાની હારે ચાહ્યે જ ઝૂટકો છે.

૨

૭૨ માણુસને આજના જમાનામાં રહેવું હોય, તો પુસ્તકાલય અને વાચનાલય એ તેને માટે અનિવાર્ય વસ્તુ છે.

અને પુસ્તકાલયો તો આજના યુગ ઉપરાંત માણુસોને પુરાણા ચુગમાં સહેલ કરવાની પણ સુંદર તક આપે છે; એટલું જ નહિ પણ આપ્યી પૃથ્વીના દેશોમાં પહેલાં અને આજે, જે જે મહાન મુરુખો થયા હોય, જે જે ઉથલપાથલો થઈ હોય, માનવે જે જે વિચાર્યું હોય અને જે જે કર્યું હોય, તે અધાર્યનો આખેહુબ ચિતાર આપણી પાસે રળું કરે છે. જે લોકો આવી સર્વ દેશીય માનવ પ્રવૃત્તિ-ઓથી આજે વાકેકું ન રહે તેઓ આજના માનવ સમાજના કોઈ પણ ક્ષેત્રમાં નેતા થવા માટે એટલા ઓછા અધિકારી છે, એમ આપણે કહેવું જોઈએ.

—નૃ. કા. લદ્દો

૭૩ વાંચવાનો નાફ લાગ્યા પછી વાચકને કંદ્ધ ને કંદ્ધ વાંચવું જ ગમે, વાંચ્યા વિના એન પડે નહિ. શું વાંચવું ધોટે ને શું ના વાંચવું ધોટે એનો વિવેક તેનામાં હોય નહિ: એટલે વખતે તે ન વાંચવાનું વાંચ્યું કરે ને તેથી વાંચવાનું રહી જાય એ બનવાળેગ છે. પરંતુ એવો માણુસ જે ભ્રષ્ટ વાચનમાં ઉતરી જાય અને તેથી એનું જીવન જે ભ્રષ્ટ થાય :તો એનું પાપ એના હાથમાં એવાં પુસ્તકો મૂકુનારને માથે !

—નરસિંહભાઈ ધર્મરાજ પટેલ.

૬૪ જે વાચનાલય કે પુસ્તકાલયની સારી મહત્ત્વા સમજય તો આમ સુધારણાના વિકટ પ્રશ્નને ધેણે સરળ કરી શકાય. આમ સુધારણાની બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર વાચનાલય અથવા પુસ્તકાલય બનાવી શકાય. ગામના લેકેડા તલાટીના અધિકારને નમશે, વેપારીની લક્ષ્મી તરફ મોહે રાખશે, પરંતુ શિક્ષકને તો સૌ ચાહુશે. માટે શિક્ષકોએ જ આમ સુધારણાના કાર્યમાં અગત્યનો ભાગ ભજવવો જોઈએ. ઉનમાંક્રમાં જે ઉત્કાન્તિ પિણખર્ગ નામના શિક્ષકે કરી હતી, તે ઉત્કાન્તિ ગામડાંના શિક્ષકો કરી શકે. વાચનાલય કે પુસ્તકાલય તે ગામડાંની ઉનનતિની સાચી ચાવી છે. શું આ ચાવીનો ઉપયોગ પણ શિક્ષકો નહિ કરે?

—હુગાર્થાંકર કદ્યાણણ.

૧

૭૫ સાચું પુસ્તક તો એ છે કે જે વાંચ્યા પછી આપણું છૂદ્ય સાન્નિધ્ય આનંદ અનુભવે અને તેના વિચારોથી આપણને વધારે વિચારશીલ, વધારે દીર્ઘદર્શી અને ચારિત્રશુદ્ધ બનવામાં સહૃદાતા મળે.

૨

૭૬ બળરમાં ભળતી બધી ચીને જેમ ધરમાં વસાવાય નહિ કે વપરાય નહિ, તેમ છપાય તેટલાં બધાં પુસ્તકો પુસ્તકાલયમાં લવાય નહિ તેમ વંચાય પણ નહિ. એટલે પુસ્તકોની અનિવાર્ય જરૂર અને તેથી પુસ્તકાલયની પણ જરૂર આપણે સ્વીકારીશું; પણ પુસ્તકો વાંચવામાં અને સંગ્રહવામાં આપણી દાખિનું સ્પષ્ટીકરણ કરી દેવું જોઈએ.

૩

૭૭ પુસ્તકોનો મોટામાં મોટો ઉપયોગ વાચકને જીવનમાં પ્રેરણ્યા આપવી, તેનામાં રહેલી સદ્ગુરૂત્તિઓને ઉત્સેજન આપણું અને કુરૂત્તિઓને શુદ્ધ કરવી એ છે. તેથી ઉત્તરતો પુસ્તકનો ઉપયોગ નવરાશના વખતમાં માણ્યસના ચિત્તને સદ્ગુરૂવિચાર તરફ દોરવું એ છે.

—પુરુષોત્તમ છ. શાહ,

૭૮ નાનુંશું મકાન, નાનોશો ખગીચો, એક ખૂણે કુવો,  
હુલશીના કયારા, નાનું એવું કમ્પાઉન્ડ, રેતી પાથરેદો ચોક અને  
વચમાં ચારે અથવા ત્રણે બાળુ છૂટી ઓસરીવાળું બેઠી ખાંધણીનું  
મૌક્કિંગ જેવું નિર્મળ મકાન, જેના અંદરના લાગમાં સ્વર્ગ સાઢો  
સામાન અને ચેતનાપ્રેરક પુસ્તકેનો સંથડું: આટલું જ્યાં વિદ્યમાન  
હોય અને તેમાં રસ્તરઝોળ ઉમંગી પુસ્તકાધ્યક્ષ નિવાસ કરતો હોય,  
તો એ સંસ્થા આગળ વિશ્વવિદ્યાલય પણ ડૂલ છે !

—પ્રતાપરાય ક. બુદ્ધ.

૭૯ કારીગર માત્રને પોતીકાં ઓનારો અને કારખાનાનો ખપ  
પડે છે. તેમના વગર તેમનું ટકુ લવલેશ ચાલતું નથી. વિદ્યાર્થીઓની  
ખાખતમાં પણ તેમજ સમજવાનું છે. પુસ્તકો એ તેમનાં ઓનારો  
છે ને પુસ્તકાલય એ તેમની પ્રયોગશાળા છે; પરંતુ પુસ્તકો એ  
પુસ્તાં ઓનારો કરતાં વિશેષ ચોણ્યતા ધરાવે છે.

—ડા. અલ્લયારી,

૮૦ સંસ્કૃતિનો લેશમાત્ર પણ દાવો ધરાવનાર સુધરેલા ગણુતા  
દેશમાં લોકો સહેલાઈથી લાલ લઈ શકે એવાં સાર્વજનિક પુસ્તકાલયો  
નિબાવવાં એ રાજ્યની ફરજ છે.

—રા. ખા. ડા. માતીસાગર.

૮૧ વિક્રતા અને જીવનના અનુભવોથી ઓપતાં, મહાન ખુદ્દિ-  
શાળી પુરુષોનાં વચનામૃતોના સંથડ, એજ પુસ્તકાલય ! હુઃખમાં  
દિલાસો હેનાર, જીવનના અટપટા માર્ગમાં સાચો અને સરળ પંથ  
કશ્ચાવિતાં પુસ્તકેનો સમૂહ, એજ પુસ્તકાલય ! મનુષ્યની ખુદ્દિ,  
નીતિ અને ચારિત્રને પોષક એવાં પુસ્તકેનો સંચય, એજ પુસ્તકાલય !  
આવાં પુસ્તકાલયો ગામડે ગામડે ને ઘેરેઘેર હજે !

—હરિસુત પી. દેસાઈ,

૮૨ પુસ્તકેનો છૂટથી વપરાશ થાય, એ જ પુસ્તકાલયનો ઉદેશ હોય. વપરાયા વગરનાં નકામાં કાણાટમાં સડયાં કરે એ પુસ્તકે ગામમાં હોય તો એ શું ને ન હોય તો એ શું ? એવાં પુસ્તકેવાળું પુસ્તકાલય એ પુસ્તકાલય કરતાં પુસ્તકેનાં સંઅહસ્થાનના નામને જ વધારે ઉચિત વૈખાય.

—ના. નં. ચોકસી.

૮૩ પુસ્તકાલય શારદા મંદિર છે. તેમાં પાણાણુની પ્રતિમાનાં પૂજન અર્થન નથી. તેમાં અનુભવીઓનાં અનુભવરહસ્ય-માર્ગ ભૂસ્યાંને માર્ગ દર્શન કરાવતાં અનુભવ રહસ્ય જ-હોય છે; જનતા તેમાંથી પ્રેરણું મેળવે છે; પોતાના પંથને ઓળખે છે, ને એ રીતે રાષ્ટ્રચેતનનાં બાબતપાદપો કુલે છે ને ઝોરે છે.

—મનઃસુખલાલ મગનજાત જવેરી.

૮૪ ગામનું પુરતકાલય એ ગામના બુદ્ધિવૈલખનું પ્રદર્શન છે. ગામનું પુસ્તકાલય એ ગામ અને જગતનો સુખચોગ છે. પુસ્તકાલયના ટેલીટકાપથી ગામ જગતને બુઝે છે, અને તે દ્વારા જીવનના સંહેશા જીવે છે; આમ ગામ જમતની સાથે જીવે છે.

—ઇન્ડિયસાદ લંહ.

૮૫ નાનાં જામડાંથી માંડીને મોટાં શહેરોમાંનાં પુસ્તકાલયોમાં મતુષ્ય પ્રેમની લાવનાથી યોજાયાં પુસ્તકે ઉલરાય અને તેનું વાચન બહેણા પ્રમાણુમાં ઝેકાય, તો જ કોમીવાદનાં એર ઓસરી છિંઘના પ્રજાજીવનમાં અમૃતનું સિંચન થઈ શકે.

—રાજેન્દ્ર સોમનારાયણ દલાલ.

૮૬ પુસ્તકાલયો શુરુની ગરજ સારે છે. બુદ્ધિપૂર્વક તેમનો ઉપચોગ થાય તો તેઓ જીવનમાં ઉત્ત્રાસ ને પ્રગાઢ શાંતિ પ્રેરે છે. શુરુ જીવતાં સુધી જીવનના દાન કરે છે, ત્યારે થંથાલયોમાં તો જીવનના અખૂટ બંડાર કાયમ માટે ચિકાર હોય છે ને કોઈ જાતની લાદય કે લોલવૃત્તિ વિના પરમાર્થ રીતે હુઃખીને દ્વિલાસાતું સાધન પૂરું પાડે છે. એવાં પુસ્તકાલયોનો લાલ તે કેમ જરો કરાય ?

—શોક શ્રી ચીમનલાલ ગિરધરલાલ  
( જવેરચંદ લક્ષ્મીચંદવાળા )

૧

૮૭ સારા અંથો ચારિયને ઉન્નત કરે છે, રૂચિને શુદ્ધ કરે છે, હુલકા આનંદોનો મોહ મટાડે છે અને આપણુને ઉચ્ચકીને વિચાર અને જીવનની ઉચ્ચય ભૂમિકા પર મૂકી હે છે.

૨

૮૮ આપણે ગરીબ હોઈએ, સમાજથી તિરસ્કારયેલા હોઈએ અને સંત સમાગમની તક ન મળતી હોય, છતાં પણ પુસ્તકોને તો આપણે આપણા ઉત્તમોત્તમ મિત્રો બનાવી જ શકીએ અને સર્વ સુગોના મહાન આત્માએ સાથે ધરાઈ ધરાઈને વાર્તાલાપ કરી શકીએ.

૩

૮૯ પ્રભાએ ઉન્નત અને અવનત થાય છે, શહેરો નાશ પામે છે, વિશાળ સાઓન્યો પાયમાલ થઈ જાય છે; પરંતુ તેઓના સમસ્ત ભૂતકાળ પુસ્તકોમાં વિદ્યમાન હોય છે. એકવારના બળવાન અયો-ધ્યાનો, હસ્તિનાપુરનો, મગધનો અને થીસ તથા ઈરાનનો બધો ભાગ પુસ્તકોમાં રહેલો છે. તેમનાં લશકરો અને શીવપુરીના નષ્ટ થઈ તેનાં માત્ર થોડાં ખંડોરો જ આજે ઉલાં છે; પણ તેનાં પુસ્તકો તો સદ્ગુરુના રહી મનુષ્યો પર અસર કર્યા જ કરશે.

૪

૯૦ આપણા દેશના પ્રત્યેક ઘરમાં જે ઉત્તમોત્તમ પુસ્તકોનો સંશ્રહ હોય તો આપણી સંસ્કૃતિમાં કેટલો મોટો ફેરફાર થઈ જાય !

૫

૯૧ ગમ્મત મેળવવાનું બીજું કોઈ પણ સાધન વાચનના જેટલું સસ્તું નથી અને કોઈ પણ આનંદ એના જેટલો ટકાઉ હોતો નથી.

૬

૯૨ જરૂર પડે તો થીંગડાં દીઘેલાં કપડાં અને સાંઘેલા જેડા પહેરને પણ પુસ્તકો લેવામાં કંનુસાઈ કરશો નહિ. તમારાં બાળ-કુને બીજુ રીતે શિક્ષણું ન આપી શકો તો હશો, પણ તેમને થોડાંક ઉત્તમ પુસ્તકો તો જરૂર આપને કે જેના સહૃદ્યોગથી તેઓ ઉન્નત થઈ માન મેળવે. જે બાળકેના હાથમાં ઉપયોગી અંથો આવે છે, તેઓ ગરીબમાં ગરીબ હોય તો પણ શાળા જેટલું કે તેથી વધારે શિક્ષણું મેળવી શકે છે.

—લાગ્યના સૃષ્ટાયોમાંથી,

<sup>૧</sup>  
૬૩ પુસ્તકાલય એ મનુષ્યનું સાચું અને સર્વોદેશીય મનુષ્યત્વ ખીચવવા ઉપરાંત મનુષ્યને જગતના જ્ઞાનચોકમાં ઉભા રહેવાનો તાકાત અને વીર્યબળ ખાક્ષનાડું અજેડ ઔષ્ઠધાલથ છે.

<sup>૨</sup>  
૬૪ ગામડાંનાં લોળાં માનવી હમેશાં દેવમંહિરે જઈ દેવદર્શિન કરવાનું નથી ચૂકતાંઃ તેવી જ ભાવના તેમને પુસ્તકાલયમાં જઈને શાન લેવાની તથા દેશના વિવિધ સમાચાર જાણવાની થાય, ત્યારે જ ગ.મડાંનું ભાવિ ઉજ્જવલ અનવા માંડયું છે, એમ સમજવું.

--પુસ્તકાલયનાં પ્રકાશ કિરણું--કિરણ ૧૦ અને ૨૩.

<sup>૩</sup>  
૬૫ પુસ્તકોના વાચનથી વિચાર સાથે આચાર પણ ધણા માણુસેના સુધરી જાય છે. પુસ્તકો સન્નિમતોની ગરજ સારે છે. પુસ્તકોની જેને મૈન્નિ હોય છે તેને જંગલમાં પણ મંગા થાય છે.

<sup>૨</sup>  
૬૬ આદર્શપૂર્ણ પુસ્તકોનું વાચન અમૃત તુલ્ય છે. અસાધુ પુસ્તકોને સેવશો તો તમે અસાધુ અનશો.

<sup>૩</sup>  
૬૭ સંતોષમાં સુખ છે. પણ ઉત્તમ પુસ્તકો પ્રતિ વાચનનો અસંતોષ રાખવો એ દ્યુત છે.

—નિવૃત્તિ વિનોદમાંથી.

૬૮ કેવળ પુસ્તકો વાંચવાથી જ ખુદ્ધિ વધે છે એમ નથી. તે દ્વારા આપણામાં સ્વતંત્ર વિચાર ઉત્પત્ત થવા જોઈએ. કોઈ ગમે એટલું વાંચશો પણ તેની ખુદ્ધિ તો વાંચેલાં પુસ્તકોના વિષયો પર તેણેટલું ચિંતન અને મનન કરશો તેના પ્રમાણુમાં જ વધશો. પેલી દલપતરામ કવિની પ્રખ્યાત કરી :—

‘વાંચે પણ નહિ કરે વિચાર તે સમજે નહિ સધગો સાર.’

યાદ કરોઃ પુસ્તકો વાંચવાનો ખરો ઝાયદો તો તેમાં લખેલી ખાખતો પર વિચાર કરવાની અને ખને તેટલું તેમાં જણ્ણાંયા પ્રમાણુનું વર્તન રાખવાથી જ થાય છે.

—સ. સા. વ. કા. ની ‘શુંકી વાર્તાઓ ભા. ઉ જો.’

પુસ્તકાલય

સુલાઘિત સમુચ્ચય

ખંડ - ૨

---

પા શ્રાત્ય જ નો ના

---

૧ આમ વર્ગને માટે સાર્વજનિક શિક્ષણુનો પ્રબંધ કરવો એ રાજ્યની અગત્યમાં અગત્યની ક્રરજ છે. આ અનિવાર્ય ઉદ્દેશની સિદ્ધિ અર્થે ઉપયુક્ત રીતે ખર્ચની કોઈ પણ રકમનો ઈન્કાર ન જ થયો જોઈએ. ઉલંબું, જાહેરમતે તો ‘નાણું જેટલું વધારે વિવેકપુર: સર ખર્ચની તેટલું દેશહિતની દસ્તિએ સારું’—એ સિદ્ધાંતને પસંદગી આપવી જોઈએ. આમ વર્ગની જ્ઞાનસંપત્તા જેવો સોંઘો વીમો, રાષ્ટ્રો માટે અન્ય કોઈ જ નથી.

—એન્ડ્ર્યુ કાર્નેંગી.

૧

૨ પુસ્તકાલયોનો ઉપયોગ મોટાં શહેરો તથા નગરોમાં રહેનારાં મનુષ્યો જે મોટા હક્કો લોગવે છે, તે પૈકીનો એક મોટા હક્ક છે. મફત પુસ્તકાલય એ એક જાતનું સાંસારિક હેવળ છે; જમાના-ઓના મોટામાં મોટા અવાજે સાંભળવાનું મંદિર છે, સર્વ ભૂમિઓ-માંથી લેગા કરેલા ઉહાપણુનો લંડાર છે; અને જે તેનો યથાવતુ ઉપયોગ કરે છે તે વગર ખર્ચે પોતાને માટે ઉચ્ચ કેળવણી પૂરી પાડે છે. જ્યાં સુધી આ સત્ય પિછાનાશે નહિ અને દરેક શહેર તથા ગામમાં મફત પુસ્તકાલય થશે નહિ, ત્યાં સુધી આપણે જંગલી અથવા તો સારામાં સારા તો જંગલી દશામાંથી ફૂકત થોડાક મુક્ત થયેલા ગણુવા જોઈએ.

૨

૩ પુસ્તકાલયમાં જઈને તેની ઝુલ્લી અને તાત્કાલિક ઉપયોગિતા વિચારીએ તો આપણુને સમજાશે કે કોઈ પણ ધંધાને લાયક થવાની તૈયારી માણુસ અહી કરી શકે છે. પોતાના ધંધાને લગતી ઉપયોગી હકીકતો એકઠી કરી શકે છે; પરીક્ષા માટે તૈયારી કરી શકે છે; એથી જ પુસ્તકાલયની ઉપયોગિતા અનંત અને અમૂલ્ય છે. એ વિનોદનું રથળ પણ છે; કારણ કે ત્યાંના જેવો નિર્દેખ, ચંદુર, ચેતનપ્રદ અને ગૃહસ્થાઈલર્યો આનંદ થીજે કોઈક જ સ્થળે મળવાનો.

—રૈલ. ડાયલ્ફુ. કે. તાસોન.

<sup>૧</sup>  
૪ ધાર્મિક, રાજક્ષારી કે સામાજિક લેદલાવ રાજ્યા વગર તમામને ઉચ્ચય આનંદ અને તલસ્પર્શી જ્ઞાનની શોધ માટે એકત્ર કરે એવું સ્થાન પુસ્તકાલય છે. વતન પ્રત્યેની ભમતાના પાયા રૂપ સ્થળિક સાર્વજનિક છિતના કામ માટે સહુમાં તે એક સરળી ધગશ્શ ઉત્પન્ન કરે છે.

<sup>૨</sup>  
૫ જે પુસ્તક ધ્યાનપૂર્વક વાંચાયું, વિચારાયું તે આપણું થઈ ચૂકયું. પરિચય વધારવા માંડીએ ત્યાર પહેલાં બધી વખત મેત્રની અગાઉથી પસંદગી થઈ શકતી નથી; પરંતુ પુસ્તકેની તો કોઈ પણ વખતે પહેલેથી પસંદગી થઈ શકે છે. જગતે આજ સુધીમાં જાણોલાં શ્રેષ્ઠ, સૌથી વધારે ડાહ્યાં સ્વીપુર્ણો સાથે દહાડામાં થાડી ઘણી મિનિટો ધારીએ તો સુધેથી ગાળી શકાય.

<sup>૩</sup>  
૬ સંસ્કારી અને શિષ્ટ ગણુતા સમાજના સહવાસમાં આવતાં આપણે એક જાતનો આત્મસંતોષ અનુભવીએ છીએ. નિર્દેશ અને વિચારચમતૃત્વિવાળું પુસ્તક વાંચતાં આપણી સ્વમાન-વૃત્તિ વધારે પ્રમાણુમાં જગૃત થવી જોઈએ; કારણું કે એવે વખતે તો આપણે સંતોના સહવાસમાં આવીએ છીએ.

<sup>૪</sup>  
૭ હુમેશાં કંઈ આપણે આપણા સાથીએ પસંદ કરી શકતા નથી; પરંતુ તમારાં પુસ્તકો તો તમે હરહુમેશ પસંદ કરી શકો છો. જે તમારી મરજી હોય તો, જગતમાં કોઈ પણ સમયે વિખ્યાત થઈ ગયેલાં ઉત્તમમાં ઉત્તમ અને ડાહ્યામાં ડાહ્યાં નરનારીએ સાથે દરરોજ થાડી પળો તમે ગાળી શકો છો. તમારાં જાણીતાં મનુષ્યો, તમે કહેલી અને કરેલી બાબતો અને તમારાં વાંચેલાં પુસ્તકો, એ બધાં હવે તો તમારું એક અંગ જ થઈ પડ્યાં છે.

<sup>૫</sup>

૮ મિત્રો મેળવવા હુમેશ સુલાલ નથી હોતું; પરંતુ પુસ્તકો સંખ્યાંધી તેમ નથી. તમારી ઈચ્છા હોય તો પુસ્તકો દ્વારા તમે દરરોજ કેટલોક સમય હુનિયાનાં શ્રેષ્ઠ અને ડહાપણુલર્યાં સ્વીપુર્ણોની સંગતિ મેળવી શકો.

—જે. સ્વી ડાના.

૯ સાર્વજનિક પુસ્તકાલય એ પ્રજાની માલિકીની સહકારને ધોરણે ચાલતી અને દરેકે દરેક વ્યક્તિને વગર લવાજમે પુસ્તકો વાંચવા આપનારી સંસ્થા છે.

—ઇલાઘન.

૧૦ વાંચવું, નિશાન કરવાં અને શીખવું એ સાર્દ છે; પણ અંદરખાનેથી પચાવવું એ વધારે સાર્દ છે. વાંચવું એ સાર્દ છે, વિચારવું એ વધારે સાર્દ છે. વિચાર્યા વગર દશ કલાક વાંચવું તેના કષ્ટાં એક કલાક વિચારવું એ વધારે સાર્દ છે.

—રૈલ. એ. કુમેરન.

૧૧ કંઈક એવું નોંધેલું મને યાદ છે કે પુસ્તકનો ઉપયોગ આપણે મધમાખ જેમ કુલનો કરે છે, તેમ કરવો જોઈએ: મધમાખ કુલમાંથી મીઠાશ હરી લે છે પરંતુ તેને ધજ કરતી નથી.

—કાલદન.

૧૨ ગરીયાને દરિદ્રતામાંથી છોડાવવાની, હુઃખીઓનાં હુઃખ ફર કરવાની, શરીર તથા મનનો થાક ઉતારવાની, અને માંહાંએનું દર્દી ભૂલાવી હેવાની, અંથેમાં જેટલી શક્તિ છે, તેટલી શક્તિ ધણું કરીને કોઈ ચીજમાં નથી.

—માર્ડન.

૧૩ પુસ્તકો રૂપી શિક્ષકોને જનતામાં ફરતા કરવાથી તોપો, ચાન્ત્રિક સાધનો અને ધારાશાસ્ત્રીએ કરતાં પણ વધારે સારાં પરિષ્ઠુમ નીપળવી શકાય છે.

૨

૧૪ તોઝાની કાન્તિએ કરતાં પુસ્તકાલયોનો શાન્તિમય પ્રચાર અવધુનીય લોકકલ્યાણ ફેલાવી જનતાની આખાદી ચિરસ્થાયી કરે છે, ગમે તે લોગે પણ પુસ્તકોનો સારો ફેલાવ કરવો જરૂરી છે.

૩

૧૫ ઉત્તમ પુસ્તકોમાં મહાન પુરેષો આપણી સાથે વાતો કરે છે, એમના પુષ્ટ કિંમતી વિચારો આપણને આપે છે, અને એમના આત્મા આપણામાં રેત છે.

—ડા. ડાયદુ, ઈ. ચેનિંગ,

૧૬ માત્ર પુસ્તકો વધાર્યે પુસ્તકાલય મમુદ્ધ થાય નહિ. વધારે પુસ્તકો ભરી તેમને કદ્દી ન વાપરવાં એ અગહળતા જુમર પાસે ઉંઘતા ખાગકના જેવી પરિસ્થિતિ છે.

—પીચેમ.

૧૭ હું ગરીભીમાં મરવું પસંદ કરું; પણ જેને વાચન અપ્રિય હોય એવો રાજ થવાનું નાપસંદ કરું છું.

—મેરોલે.

૧૮ આપણુંને ઉમરાવેની જરૂર નથી પણ ઉમદાં ગામેની જરૂર છે. નહી ઉપરનો એકાદ પૂલ એછો બાંધો; પણ જનતાની આસપાસ ઝરી રહેલી અજાન સ્થિતિ ઉપર એવી અગકતી જ્ઞાન કમાન ઉલ્લી કરો કે તેના તેજથી પ્રગતિ અને પ્રચાર પૂર વેગે વધે અને નિરક્ષરતાનો અંધકાર એસરી જય.

—શરો.

૧૯ શિક્ષણ ને થાંથનો સંખ્યા ધર્ણો નિકટનો છે; કઃરણ કે શિક્ષણના શિખરે પહોંચનારાંએ જે પોતાના તેમજ પરદેશના વિક્ષાનોએ સંચિત કરેલાં જ્ઞાનનો લાલ લીધા ન કરે તો તેમનો માનસિક વિકાસ કુંઠિત થઈ જવાનો અને તેમની પ્રગતિ અટકી પડવાની. જગતમાં ચાઢી રહેલી અનેક વિધ પ્રવૃત્તિથી માહિતગાર થવાની જિજાસાવૃત્તિ ન ખીલે તો લીધેલું શિક્ષણ એળે ગયું સમજવું. પુસ્તકાલયનો ઉદ્દેશ એ વૃત્તિને દૈનવવાનો અને સંતોષવાનો છે.

—લોડ હાડિંજ.

૨૦ નવરાશની નકામી ધરીએ વાંચવાની ટેવ પાડો, અને જે વાંચો યા વાંચતા હો તેની તમારી પોતાની શક્તિ અનુસાર કિંમત આંક્તા રહેવાની સતત ટેવ પાડો. કોઈએ કહું છે તેમ ઉત્તમ પુસ્તક હુથમાં નહિ, પણ એણામાં રાખવું જેઠાએ; કારણ કે વાંચતી વખતે વિચારવા, પચાવવા અને તુલના કરવા આપણુંને વારવાર અટકવું પડશે. વળી આપણુંને રસ ન પડે એવું પુસ્તક અધુરું છોડી દેવામાં કંઈ નાનમ કે શરમાવા જેવું છે એવી સંકુચિત મનવાળાઓની ભ્રમણાથી દોરવાઈ જવાની પણ જરૂર નથી. બધાં પુસ્તકો બધી પ્રકૃતિઓને કે સર્વ કાળે અતુકૂળ જ હોતાં નથી અને સાચો આનંદ આપે એવાં તરફ વળવું પડે એ સમજ લેવું બહુ જરૂરનું છે.

—લોડ ધરવિન,

૨૧ શાળાનું પુસ્તકાલય એટલે ખાળવિદ્યાર્થી માટે આધ્યાત્મિક અને સંસ્કારિક વૃત્તાંતોની નવીન હુનિયા; અને શ્રીકૃપર્ગનાં સાધન તથા શક્તિમાં અપૂર્વ અલિવૃદ્ધિ કરનાર પારસમણી! શાળાને પોતાને માટે તે વિદ્યા અને વિક્રિતાનું અવનતું વાતાવરણ જમાવે છે, અને બુદ્ધિગમ્ય વસ્તુઓ વિષે તે અભિનવ દાખિ સરમેં છે.

— લીય વિદ્સન.

૨૨ સ્વયંપ્રેરિત વિદ્યાર્થીના જીવનમાં અવાચ્ય આનંદ હોય છે. પહેલી વખત જ્યારે મેં એક સરસ પુસ્તક વાંચ્યું, ત્યારે મેં એક નવો મિત્ર મેળોયો હોય નેમ મને લાગ્યું. મેં પહેલાં વાંચેલું પુસ્તક જ્યારે જ્યારે હું કેરી વાંચવા માંડું છું, ત્યારે ત્યારે મને એમ થાય છે કે જાણે હું કોઈ જ્ઞાન મળું છું.

— એલિવર ગોડસિભથ

૨૩ જે જે સ્થળોએ સાર્વજનિક પુસ્તકાલયનું અસ્તિત્વ છે લ્યાં ત્યાં માત્ર અમુક વર્ગને માટે જ નહિ, પણ સહજ મળતાં સાધનોનો લાલ લેવાની વૃત્તિવાળાં અને શાહેરી જીવનની ધમાલમાંથી પુસ્તકાલય દ્વારા વાહુમયના જ્ઞાનપ્રકાશનો દહોવા લેવાં ઉત્સુક એવાં કોઈ પણ ચુવક ચુવતીને માટે પ્રગતિનાં દ્વાર ખુલ્લાં છે. પુસ્તક વિના શાહેરમાં રહેનાર કોઈ પણ શ્રીકૃતિ ચુવક ચુવતીને ગરીબાધિના જેવી જ પુસ્તકોની હાડમારી વેઠવી પડે છે. પુસ્તકોનિનાનું શાહેર એ અજવાળાનાં સાધન વગરના ગામ જેવું છે.

એચ. એ. એલ. ફીરાર.

૨૪ પુસ્તકો એ મિત્રવિહોણુંઓનાં મિત્રો છે; અને પુસ્તકાલય એ ગૃહનિહોણુંઓનું ગૃહ છે. વાચનનો શોખ તમને હમેશા મળી શકે તેવી સારામાં સારી સંગતમાં લઈ જશો અને જે માણુસો એમના ડહાપણુનો લાલ આપી શકે તથા એમના વિનોદથી આનંદ આપી શકે તેવાં હશે તેમની સાથે વાતચીત કરવા શક્તિમાન બનાવશે.

— લ. એસ. હિલાર્ડ.

૨૫ શીષ સમાજનો લાલ, નીકર જેઓ ન માણી શકતા હોય તેવા અનેકને પુસ્તકાલય તે લાલ પૂરો પાડે છે. વ્યક્તિત્વના ચારિન્ય પર પ્રભાવ પાડનારી વસ્તુઓમાં પુસ્તકાલય એ અગત્યમાં અગત્યની વસ્તુ છે. મનુષ્ય પોતે જે જાતની સોખત સેવતો હોય છે તેના પરથી તે પિછાનાય છે; એટલું જ નહિ પણું તેના સોખતીઓની અસર તેના જીવન પર મસ મોટા પ્રમાણમાં પડતી હોવાથી તેનું જીવન કંઠા વિકસે છે કે પછી કથળે છે. આપણે જે કંઈ શીખીએ છીએ અને આપણે જેવા હોઈએ છીએ, તેનો મોટો લાગ તો આપણી આજુ-આજુની પરિસ્થિતિમાંથી અનાણુતાં આપણું જીવનમાં ઉત્તરેલો હોય છે.

—વિલિયમ આર. ધરસ્ટમેન.

૧

૨૬ થંથ એ ઉત્તમ સોખતી છે. તમો ઈચ્છો ત્યારે જ એ પોતાના સર્વ ધોધ સહિત તમારી સમક્ષ આવે છે. તમારી પૂંડ તો તે કદી જ પડકતો નથી; તમારા હુલ્કથી એ શુસ્સે થતો નથી; તમો ખીંજ આનંદો તરફ વળો તો તે ઈર્ષાળું બનતો નથી, અને કશો જ બહદો લીધા કે માર્ગયા વિના મુંગે મોઢે તે તમારી સેવા કર્યે જાય છે. તે પોતાના શરીરમાંથી નીકળી તમારી સમરણ શક્તિમાં પ્રવેશતો જાય છે. તેનો આત્મા ઉડીને તમારામાં દાખલ થાય છે અને તમારા મજજ પર કાણું જમાવે છે.

૨

૨૭ પુસ્તકો એ આત્માની ભારીએ છે : આત્મા તે દ્વારા અહાર જુએ છે. પુસ્તકો સિવાયનું ઘર એ ભારીએ સિવાયના એરડા જેવું છે. માણુસ પાસે પુસ્તકો ખરીદવા પૂરતું સાધન હોય તેમ છતાં તેનાં ખાળકોને પુસ્તકોની સંનિધિના અલાવમાં ઉછેરવાનો એને હજુ નથી. એ એનો કુદું બદ્રોહ છે : એ એમને છેતરે છે.

—હેન્રી વ્હાઈ બીચર,

૨૮ મારા વાચનના પ્રેમને ખદ્દે કોઈ ખધાંય મહારાજેના  
તાજ મારી સામે ભૂકે તો તેને પણ લાત મારીને હું ઝેંડી દઉ.  
—ફ્રેનલીન.

૨૯ હાલમાં મારાં ઘણું ભિત્રો છે અને હું તેમને ચાહું છું.  
પણ તેમના કરતાં સારા વાચનને હું વિશેષ ચાહું છું.  
—પેટ.

૩૦ કેટલાક થાંથોએ જગતનું કેટલુંચે હિત કર્યું છે અને  
હજુ કર્યો જાય છે. તેઓ જે રીતે આપણી આશા, હિંમત અને  
શ્રદ્ધાને જગાડે છે, હુંખ મટાડે છે, દુર્રાહના યુગો અને દેશોને એક  
ધોળ સાથે જોડી હે છે અને સ્વર્ગમાંથી સત્યોને લાવે છે—એ સર્વોનો  
હું જ્યારે વિચાર કરું છું, ત્યારે હું આવી ઉત્તમ ભક્તિસ મળવા માટે  
હમેશાં છસ્વરનો આલાર માનું છું.

—જેમસ ક્રીમેન કલાક્ષ.

૩૧ આપણે આપણા દોકને છાપેલું ઉકેલતાં શીખ્યું છે.  
આપણું એમને કેમ વાંચવું તે હજુ શીખ્યું નથી. આપણે આપણી  
વિદ્યાપીડિમાં તેમ કરવા પ્રયત્ન કરીએ છીએ, પણ વિદ્યાપીડમાં  
પસાર થતી પ્રજના ટકા પ્રંમાણુમાં એછા જ હોય. વિદ્યાપીડ ન કરી  
શકે તે પુસ્તકાલય કરી શકે ન તે એણે જરૂર કરવું જોઈએ.

—પ્રિન્સિપાલ આંદ રોઝર્સન બુર્ઝિંગહામ યુનિ.



यो दद्धाक्षानमस्तानं कुर्याद्वाधर्मदर्शनम् ।  
स कृत्स्नां पृथिवीं दद्धात् तेन तुल्यं न तद् भवेत् ॥

अर्थात्—अरानीओं द्यान आपनुं ने तेभने धर्मदर्शन करावनुं  
धने तेभने खरां घोटांनो भेद सभजतां करतां, ए सेवानुं पुण्य सभग्र  
पृथीना दानना पुण्य करतां पछु यढी जय छे. सभग्र पृथीनुं दान  
पछु ए सेवानी तोले आपनुं नक्षी.

—मनुसभृति.



सार्वजनिक पुस्तकालय एटले प्रजा सभस्ततुं सरसवती मंदिर !  
STEP IN PLEASE !

पुस्तकालय एटले जगत सभयना विद्वानोनी रससामयीतुं संथङ्गस्थान !

स्वागतम् ।

पुस्तकालय एटले प्रजामां प्राण पूरनार प्रगति मंदिर !  
पधारै !

आर्य सुधारक प्रेस-वडोदरा २३००-३-३४